

પાઠ 1

મિત્રના ઘરે

રમીલા : આવો, બેસો.

આવો, બેસો.

ચંદુલાલ : ઓહો, તું છે! આવ, આવ રમાકાંત.
રમીલા, આ મારા હરદ્વારના મિત્ર રમાકાંત
છે. અમે નાનપણના મિત્ર છીએ. રમાકાંત,
આ મારી પત્ની રમીલા છે. રમાકાંત,
ભાભી કેમ છે? બાળકો કેમ છે?

ઓહો, તું છે! આવ આવ રમાકાંત. રમીલા,
આ મારા હરદ્વારના મિત્ર રમાકાંત છે। અમે
નાનપણના મિત્ર છીએ। રમાકાંત આ મારી
પત્ની રમીલા છે। રમાકાંત, ભાભી કેમ છે?
બાળકો કેમ છે?

રમાકાંત : બધાં કુશળ છે. તારાં બાળકો ક્યાં
છે?

બધાં કુશળ છે। તારાં બાળકો ક્યાં છે?

ચંદુલાલ : મારો દીકરો દીપક અને તેની પત્ની
ભૈરવી વડોદરામાં છે, બંને ડૉક્ટર છે.
તેમની દીકરી કવિતા અને તેના પતિ રમેશ
અમારી સાથે છે. દીકરી મીરાં અને જમાઈ
પ્રકાશ અમદાવાદમાં જ છે.
રમીલા, કવિતા ક્યાં છે?

મારો દીકરો દીપક અને તેની પત્ની ભૈરવી
વડોદરામાં છે, બંને ડૉક્ટર છે। તેમની
દીકરી કવિતા અને તેના પતિ રમેશ અમારી
સાથે છે। છોકરી મીરાં અને જમાઈ પ્રકાશ
અમદાવાદમાં જ છે। રમીલા, કવિતા કયાં
છે?

કવિતા : દાદા હું અહીં જ છું.
દાદા હું અહીં જ છું।

મિત્ર કે ઘર

રમીલા: આઇએ, બૈઠિએ।

ચંદુલાલ: ઓહો, તુમ હો! આઓ, આઓ
રમાકાંત। રમીલા, યે મેરે હરદ્વાર કે મિત્ર
રમાકાંત હુંને। હમ બચપન કે દોસ્ત હુંને।
રમાકાંત, યહ મેરી પત્ની રમીલા। રમાકાંત,
ભાભી કેસી હુંને? બચ્ચે કેસે હુંને?

રમાકાંત: સબ કુશલ હુંને। તુમ્હારે બચ્ચે કહો
હુંને?

ચંદુલાલ: મેરા બેટા દીપક ઔર ઉસકી પત્ની
મૈરવી બડૌદા મેં હુંને, દોનોં ડૉક્ટર હુંને। ઉનકી
બેટી કવિતા ઔર ઉસકે પતિ રમેશ હમારે
સાથ મેં હુંને। બેટી મીરા ઔર જમાઈ પ્રકાશ
અહમદાબાદ મેં હી હુંને। રમીલા, કવિતા કહો
હુંને?

કવિતા: દાદાજી મેં યહોઁ હી હુંને।

રમीला : દીકરી આ પણ દાદા છે. દાદા માટે ચા-નાસ્તો લાવો.

દીકરી આ પણ દાદા છે। દાદા માટે ચા નાસ્તો લાવો।

કવિતા : દાદા નમસ્તે. ચા-નાસ્તો તૈયાર છે.
તમે બધાં અંદર આવો.

દાદા નમસ્તે। ચા નાસ્તો તૈયાર છે। તમે બધાં અંદર આવો।

ચંદુલાલ : નાસ્તામાં શું છે ?
નાસ્તામાં શું છે ?

કવિતા: ફાફડા-જલેબી.
ફાફડા-જલેબી।

ચંદુલાલ : બહુ સરસ. રમાકાંત, અહીંનાં
ફાફડા-જલેબી વખણાય છે.
રમીલા તું પણ આવ. અમારી
સાથે નાસ્તો કર.

બહુ સરસ। રમાકાંત, અહીંનાં ફાફડા
જલેબી વખણાય છે। રમીલા તું પણ આવ।
અમારી સાથ નાસ્તો કર।

રમીલા : તમે લો. મારે આજે ઉપવાસ છે.
તમે લો। મારે આજે ઉપવાસ છે।

રમાકાંત : આજે કઈ તિથિ છે ?
આજે કઈ તિથિ છે ?

રમીલા : આજે પૂનમ છે.
આજે પૂનમ છે।

ચંદુલાલ : આવ પ્રકાશ તું પણ બેસ.
આવ પ્રકાશ તું પણ બેસ।

રમાકાંત : ચંદુલાલ, આ જ તમારા
જમાઈ પ્રકાશ છે ?
ચંદુલાલ આ-જ તમારા જમાઈ પ્રકાશ છે?

રમીલા: બેટી યે ભી દાદાજી હું, દાદાજી કે
લિએ ચાય નાશ્તા લાઓ।

કવિતા: દાદાજી નમસ્તે। ચાય નાશ્તા તૈયાર
હૈ। આપ સબ અંદર આઇએ।

ચંદુલાલ: નાશ્તે મેં ક્યા હું ?

કવિતા: ફાફડા-જલેબી।

ચંદુલાલ: બહુત અચ્છા। રમાકાંત, યહું કે
ફાફડા-જલેબી પ્રસિદ્ધ હું। રમીલા તુમ ભી
આओ। હમારે સાથ નાશ્તા કરો।

રમીલા: આપ લીજિએ। મેરા આજ ઉપવાસ હૈ।

રમાકાંત: આજ કૌન-સી તિથિ હૈ ?

રમીલા: આજ પૂર્ણિમા હૈ।

ચંદુલાલ: આઓ પ્રકાશ તુમ ભી બૈઠો।

રમાકાંત: ચંદુલાલ, યે હી તુમ્હારે જમાઈ
પ્રકાશ હું ?

ચંદુલાલ : હા-હા, આ જ અમારા જમાઈ પ્રકાશ છે. પ્રકાશ, આ મારા નાનપણના ભિત્ર રમાકાંત છે, તે હરિદ્વારના છે. હા-હા, આ જ અમારા જમાઈ પ્રકાશ છે। પ્રકાશ, આ મારા નાનયણના મિત્ર રમાકાંત છે, તે હરિદ્વારના છે।

પ્રકાશ : નમસ્તે કાકા.

નમસ્તે કાકા।

રમાકાંત : દીકરી મીરાં કેમ છે ?
દીકરી મીરાં કેમ છે ?

પ્રકાશ : ભજામાં છે.
મજામાં છે।

રમીલા : ચાલો-ચાલો પહેલાં તમે સૌ નાસ્તો કરીલો, પછી વાતો કવિતા દીકરી તું પણ બેસ અને નાસ્તો કર.
ચાલો-ચાલો પહેલાં તમે સૌ નાસ્તો કરી લો,
પછી વાતો। કવિતા દીકરી, તું પણ બેસ અને
નાસ્તો કર।

ચંદુલાલ: હા�-હાঁ, યે હી હમારે જમાઈ પ્રકાશ હું। પ્રકાશ, યે મેરે બચપન કે દોસ્ત રમાકાંત હું। વે હરિદ્વાર કે હું।

પ્રકાશ: નમસ્તે ચાચાજી।

રમાકાંત: બેટી મીરા કેસી હૈ ?

પ્રકાશ: મજે મેં હૈ।

રમીલા: ચલિએ-ચલિએ આપ સબ પહલે નાશ્તા કર લીજિએ, બાદ મેં બાતોં। કવિતા બેટી, તુમ ભી બૈઠો ઔર નાશ્તા કરો।

શબ્દાર્થ

ગુજરાતી શબ્દ	દેવનાગરી	હિંદી અર્થ
તું	તुं	તુમ/તૂ
અમે	અમે	હમ
અમારી	અમારા	હમારે
આવો	આવો	આઇએ
છે	છે	હૈ/હું
બેસો	બેસો	ਬૈઠિએ
મારા	મારા	મરે
તારાં	તારાં	તેરે/તુમ્હારે
કેમ	કેમ	કैસે
દીકરો	દીકરો	બેટા
પત્ની	પત્ની	પત્ની
બધાં	બધાં	સખી

બાળકો	બાલકો	बच्चे
ક્યાં	ક्यां	कहाँ
બંને	બન્ને	दोनों
અમારી સાથે	અમારી સાથે	હમારે સાથ
અહીં	અહીં	यहाँ
દાદા	દાદા	दાદા (પિતા કે પિતા ઔર માઁ કે પિતા)
ને માટે	ને મોટે	કે લિએ
ચા	ચા	चાય
શું	શું	કયા
તैયાર	તैયાર	તैયાર
બાપુજી	બાપુજી	પિતાજી (પ્યાર સે દાદાજી કો ભી કહતે હું)
સરસ	સરસ	ઉત્તમ
તમે	તમે	आપ
ફાફડા	ફાફડા	फાફડા (તીખા વ્યંજન)
જલેબી	જલેબી	જલેબી (મીઠા વ્યંજન)
વખણાય	વખણાય	પ્રસિદ્ધ/મશહૂર
ઉપવાસ	ઉપવાસ	ઉપવાસ, બ્રત
આજે	આજે	આજ
જમાઈ	જમાઈ	જમાઈ
નાનપણના	નાનપણના	बચપનકે
કાકા	કાકા	चાચા
દીકરી	દીકરી	બેટી
ચાલો	ચાલો	ચલિએ
બહુસરસ	બહુ સરસ	બહુત અચ્છા
પહેલાં	પહેલા	પહલે
પણ	પણ	ભી
તમારા	તમારા	તુમારે
જરૂર	જરૂર	જરૂર/અવશ્ય
મારે	મારે	મુજ્જે
સૌ	સૌ	સભી

અભ્યાસ

1. નીચે દિએ ગએ વાક્ય દોહરાઇએ।

- | 1) આ મારા મિત્ર છે.
આ મારા મિત્ર છે
 - 2) અમે નાનપણના મિત્ર છીએ.
અમે નાનપણના મિત્ર છીએ।
 - 3) તમે બધાં કેમ હો ?
તમે બધાં કેમ છો ?
 - 4) દાદા હું અહીં જ છું.
દાદા હું અહીં જ છું।
 - 5) ઓહો તું છે ?
ઓહો તું છે ?
 - 6) તારાં બાળકો ક્યાં છે ?
તારાં બાળકો ક્યાં છે ?
-
- 2. 1) કવિતા ક્યાં છે ?
કવિતા ક્યાં છે ?
 - 2) બાળકો કેમ છે ?
બાળકો કેમ છે ?
 - 3) નાસ્તામાં શું છે ?
નાસ્તામાં શું છે ?
 - 4) આજે કઈ તિથિ છે ?
આજે કઈ તિથિ છે?
-
- 3. 1) આવો બેસો.
આવો બેસો।
 - 2) તું પણ બેસ.
તું પણ બેસ।

- 3) પ્રકાશ, બેસ.
પ્રકાશ, બેસ।
- 4) તમે પણ લો.
તમે પણ લો।
- 5) ચા નાસ્તો લાવો.
ચા નાસ્તો લાવો।
4. 1) દીકરી મીરાં અને જમાઈ પ્રકાશ અમદાવાદમાં જ છે ?
દીકરી મીરાં અને જમાઈ પ્રકાશ અમદાવાદમાં જ છે।
- 2) અહીંના ફાફડા-જલેબી વખણાય છે.
અહિના ફાફડા-જલેબી વખણાય છે।

II. નીચે દિએ ગए વાક્યો મેં રેખાંકિત શબ્દોં કે સ્થાનપર કોષ્ટક મેં દિએ ગए શબ્દોં કા પ્રયોગ કર તીન-તીન વાક્ય બનાઝે।

- 1) આ કવિતા છે. (દીપક, ભૈરવી, રમીલા)
આ કવિતા છે। (દીપક, ભૈરવી, રમીલા)
- 2) આ દાદા છે. (બા, ભાભી, દીકરી)
આ દાદા છે। (બા, ભાભી, દીકરી)
- 3) આ નાસ્તો છે. (ચા, ફાફડા, જલેબી)
આ નાસ્તો છે। (ચા, ફાફડા, જલેબી)

III કોષ્ટક મેં દિએ ગए શબ્દોં મેં સે ઉપયુક્ત શબ્દ ચુનકર વાક્ય પૂરે કીજિએ।

(મારા, મારી, મારો, મારું)
(મારા, મારી, મારો, મારું)

- 1) આ દીકરી છે.
આ દીકરી છે।
- 2) આ પત્ની છે.
આ પત્ની છે।
- 3) આ ઘર છે.
આ ઘર છે।
- 4) આ જમાઈ છે.
આ જમાઈ છે।

IV उदाहरण के अनुसार दिए गए वाक्यों का विस्तार कीजिए।

उदाहरणः आवो, तमे आवो.
आवो, तमे आवो।

- 1) बेसो,
बेसो,
- 2) चालो,
चालो,
- 3) नास्तो लावो,
नास्तो लावो,

V. उदाहरण के अनुसार नीचे दिए गए वाक्यों का परिवर्तन कीजिए।

उदाहरणः तुं आव.
तुं आव।
तमे आवो.
तमे आवो।

- 1) तुं बेस.
तुं बेस।
- 2) तुं ले.
तुं ले।
- 3) तुं चाल.
तुं चाल।

VI कोष्ठक में दिए गए शब्दों में से उपयुक्त प्रश्नवाचक शब्द चुनकर प्रत्येक वाक्य के प्रश्नवाचक रूप बनाइए।

(क्यां, केम, शुं, कई, कोण)
(क्यां, केम, शुं, कई, कोण)

- 1) दीपक अने भैरवी वडोदरामां छे।
दीपक अने भैरवी वडोदरामां छे।
- 2) भाभी अने बाल्को कुशल छे।
भाभी अने बाल्को कुशल छे।

- 3) આજે પૂનમ છે.
आજે પૂનમ છે।
- 4) કવિતા અહીંયાં છે.
કવિતા આહીંયાં છે।
- 5) નાસ્તામાં ફિફડા-જલેબી છે.
નાસ્તામાં ફાફડા-જલેબી છે।

VII ઉદાહરણ કे અનુસાર નીચે દિએ ગए શબ્દોं કे લિંગ બદલિએ।

ઉદાહરણ: દીકરો-દીકરી
 દીકરો-દીકરી

- 1) પત્ની -
પત્ની -
- 2) દાદા -
દાદા -
- 3) કાકા -
કાકા -

VIII પ્રત્યેક શબ્દ સમૂહ મેં જો શબ્દ ઉસ વર્ગ કા ન હો ઉસે પહ્યાનિએ।

- 1) દીકરો, દીકરી, જલેબી, દાદા, ભાભી.
દીકરો, દીકરી, જલેબી, દાદા, ભાભી।
- 2) અમદાવાદ, વડોદરા, હરદ્વાર, અહીં.
અમદાવાદ, વડોદરા, હરદ્વાર, અહીં।
- 3) મિત્ર, દાદા, ચંદુલાલ, કાકા, જમાઈ.
મિત્ર, દાદા, ચંદુલાલ, કાકા, જમાઈ।

IX નીચે દિએ ગए વાક્યોં મેં 'માં' યા 'ના' કા ઉપયુક્ત પ્રયોગ કર વાક્ય પૂરે કીજિએ।

- 1) આ મારા હરદ્વાર મિત્ર છે.
આ મારા હરદ્વાર મિત્ર છે।
- 2) આ મારા જમાઈ પ્રકાશ, મીરાં પતિ છે.
આ મારાં જમાઈ પ્રકાશ, મીરાં પતિ છે।
- 3) દીપક અને તેની પત્ની વડોદરા છે.

દીપક અને તેની પત્ની વડોદરા છે ।

4) દીકરી અને જમાઈ અહીં અમદાવાદ છે.

દીરકી અને જમાઈ અહીં અમદાવાદ છે ।

X બાયોં ઓર દિએ ગએ પ્રશ્ન વાક્યોં કે સાથ દાહિની ઓર દિએ ગએ સહી ઉત્તર સે મિલાન કીજિએ ।

પ્રશ્ન

1) નાસ્તામાં શું છે ?	આજે પૂનમ છે.
નાસ્તામાં શું છે ?	આજે પૂનમ છે ।
2) ભાભી કેમ છે ?	અહીં અમદાવાદમાં છે.
ભાભી કેમ છે ?	અહીં અમદાવાદમાં છે ।
3) તારાં બાળકો ક્યાં છે ?	ભાભી કુશળ છે.
તારાં બાળકો ક્યાં છે ?	ભાભી કુશળ છે ।
4) કવિતા ક્યાં છે ?	ફાફડા-જલેબી છે.
કવિતા ક્યાં છે ?	ફાફડા-જલેબી છે ।
5) આજે કઈ તિથિ છે ?	હું અહીં છું.
આજે કઈ તિથિ છે ?	હું અહીં છું ।

ઉત્તર

આજે પૂનમ છે.

આજે પૂનમ છે ।

અહીં અમદાવાદમાં છે.

અહીં અમદાવાદમાં છે ।

ભાભી કુશળ છે.

ભાભી કુશળ છે ।

ફાફડા-જલેબી છે.

ફાફડા-જલેબી છે ।

હું અહીં છું.

હું અહીં છું ।

પઢાએ ઔર સમઝાએ

મારો પરિચય

હું કવિતા છું. અમે બે બહેનો હીએ. મારી બહેનનું નામ અનુજા છે. અમારી બા શિક્ષિકા છે. મારું ગામ કરજણ છે. ગામમાં નાનો બગીચો છે. હું અને અનુજા અમે બંને ધોરણ આઠમાં હીએ. મારી નિશાળ ઘણી સુંદર છે. અમારી નિશાળના આચાર્ય ધીરુભાઈ છે. તમારી નિશાળના આચાર્ય કોણ છે? તમે જરૂર આવો અને અમારી નિશાળ જુઓ.

મારો પરિચય

અમે બે બહેનો છીએ। મારું નામ કવિતા છે। મારી બહેનનું નામ અનુજા છે। અમારી બા શિક્ષિકા છે। મારું ગામ કરજણ છે। ગામમાં નાનો વગીચો છે। હું અને અનુજા બંને ધોરણ આઠમાં છીએ। મારી નિશાળ ઘણી સુંદર છે। અમારી નિશાળના આચાર્ય ધીરુભાઈ છે। તમારી નિશાળના આચાર્ય કોણ છે? તમે જરૂર આવો અને અમારી નિશાળ જુઓ।

शब्दार्थ

गुजराती शब्द	देवनागरी	हिंदी अर्थ
હું	હुं	मैं
છું	छું	हूँ
જાનો	જાનો	छोटा
નામ	નામ	नाम
બે	બે	दो
બા-બાપ	બા-બાપુ	माँ-बाप
શિક્ષિકા	શિક્ષિકા	શિક્ષિકા
ગામ	ગામ	गाँव
કરજણ	કરજણ	करजण (गाँव का નામ)
બગીચો	બગીચો	बगીचા / ઉદ્યાન
બહેન	બહેન	बહન
અને	અને	और
ધોરણ	ધોરણ	કક્ષા
આઠ	આઠ	आठ
નિશાળ	નિશાળ	પાઠશાળા
ઘણી	ઘણી	बहુત
જુઓ	જુઓ	દેખિए
કોણ	કોણ	कौન

अभ्यास

I अनुच्छेद के आधार पर नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए।

- 1) ગામનું નામ શું છે ?
ગામનું નામ શું છે ?
- 2) કોણ કોણ બહેનો છે ?
કોણ કોણ બહેનો છે ?

- 3) કવિતા અને અનુજ્ઞા ક્યા ધોરણમાં છે ?
કવિતા અને અનુજ્ઞા ક્યા ધોરણમાં છે ?
- 4) ગામમાં શું શું છે ?
ગામમાં શું શું છે ?

II નીચે દિએ ગए હિંદી શબ્દોં કે ગુજરાતી શબ્દ દીજિએ।

ગાঁધ
પાઠશાળા
બહન
છોટા
દો
બહુત

III હિંદી મેં અનુવાદ કીજિએ।

મારું ઘર ઘણું સુંદર છે. મારા ઘરની બાજુમાં એક નિશાળ છે. નિશાળમાં એક નાનો બગીચો છે. હું નિશાળમાં શિક્ષક છું. નિશાળમાં આઠ શિક્ષકો છે

IV ગુજરાતી મેં અનુવાદ કીજિએ।

રમણભાઈ પટેલ ગુજરાત કે હૈનું। વે શિક્ષક હૈનું। ઉનકી પત્ની કા નામ ઉર્મિલા હૈ। પુત્ર કા નામ ચિરાગ હૈ। ઉર્મિલા બહન ભી શિક્ષિકા હૈનું। વે કોલેજ મેં હૈનું। કોલેજ કા નામ સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ હૈ।

V આપ અપના પરિચય દેતે હુએ ગુજરાતી મેં એક છોટાસા અનુચ્છેદ લિખિએ।

ટિપ્પણીયાં

I ઇસ પાઠ મેં ગુજરાતી ભાષા કે દો પ્રકાર કે વાક્યોં કા પરિચય દિયા ગયા હૈ।

1.

- 1) આ દાદા છે. યે દાદા હૈનું।
આ દાદા છે.
- 2) તમે કેમ છો ? તુમ કैસે હો ?
તમે કેમ છો ?

- 3) हੁਂ ਅਹੀਂ ਛੁ. ਮੈਂ ਯਹਾਂ ਹੁੰ।
 ਹੁਂ ਅਹੀਂ ਛੁ।

4) ਅਮੇ ਨਾਨਪਣਨਾ ਮਿਤਰ ਛੀਅ. ਹਮ ਬਚਪਨਕੇ ਦੋਸਤ ਹੈਂ।
 ਅਮੇ ਨਾਨਪਣਨਾ ਮਿਤਰ ਛੀਏ।

जिस प्रकार हिंदी के वाक्यों में 'है, हैं, हूँ, हो' जैसी योजक क्रियाओं का प्रयोग होता है, उसी प्रकार ગુજરાતી મें 'છે' (છે), 'છો' (છો), 'છું' (છું), 'છીએ' (છીએ) કा પ्रયોગ હોતા હૈ।

|| ગુજરાતી મેં વિવિધ સર્વનામો તથા 'છ' ક્રિયા કા પરિચય નિમ્ન પ્રકાર સે હૈ।

1.

	एकवचन	बहुवचन
उत्तमपुरुष	हूं छुं. हुं छुं।	मैं हूं।
मध्यमपुरुष	तुं छि. तुं छे।	तमे छि। तमे छो।
अन्यपुरुष	ते छे। (पु.स्त्री.नपु.) ते छे। (पु., स्त्री.नपुं.)	तओ छे। तो छे।
2.	आवो, जेसो。 आवो, बेसो।	आइए, बैठिए।
	तुं पए आव. तुं पण आव।	तुम भी आओ।
	चालो चालो, नास्तो करो。 चालो चालो, नास्तो करो।	चलिए-चलिए, नाशता कीजिए।
	तमे सौ ज़रूर आवो. तमे सौ जरूर आओ।	आप सब आइए।

ઉપર્યુક્ત 2 કે ઉદાહરણ મેં આજ્ઞાવાચક ક્રિયા વાળે રૂપ દિએ ગએ હોય.

આજ્ઞાર્થક ક્રિયારૂપ એકવચન ઔર બહુવચન મેં કિસ પ્રકાર બનતે હોય, યહ નીચે દિખાયા ગયા હૈ।

1)	તું આવ્ય.	તૂ આ।	તમે આવ્યો.	તુમ આઓ/આપ આઇએ।
		તું આવો।	તમે આવો।	
2)	તું બેસ.	તૂ બૈઠ।	તમે બેસ્યો.	તુમ બૈઠો/આપ બૈથિએ।
		તું બેસ।	તમે બેસો।	
3)	તું ચાલ.	તૂ ચલ।	તમે ચાલ્યો.	તુમ ચલો/આપ ચલિએ।
		તું ચાલ।	તમે ચાલો।	

III ઇસ પાઠ મેં પ્રશ્નવાચક શબ્દોની કા ભી પ્રયોગ હુआ હૈ।

- | | | |
|----|------------|-------------|
| 1) | ક્યાં છે ? | કહ્યું હૈ ? |
| | ક્યાં છે ? | |
| 2) | કેમ છે ? | કેસે હૈ ? |
| | કેમ છે ? | |
| 3) | શું છે ? | ક્યા હૈ ? |
| | શું છે ? | |
| 4) | કઈ છે ? | કૌનસી હૈ ? |
| | કઈ છે ? | |

IV

1. જિસ પ્રકાર હિંદી કે વાક્યોની મેં સંબંધ કારક દિખાને કે લિએ 'કા', 'કે', 'કી' જૈસે તીન પરસગ્યોની કા પ્રયોગ હોતા હૈ ઉસીપ્રકાર ગુજરાતી મેં 'નો' (નો), 'ની' (ની), 'નું' (નું), 'ના' (નાં) કે જૈસે ચાર પરસગ્યોની કા પ્રયોગ હોતા હૈ। ઇસ પાઠ મેં ઇનમાં સે કેવળ 'ના' (નાં) કા પ્રયોગ હુआ હૈ।

ઉદાહરણ: તેઓ અમદાવાદના છે.
તેઓ અમદાવાદના છે। વે અહમદાબાદ કે હૈનું।

ચંદુલાલ અમદાવાદના છે.

ચંદુલાલ અમદાવાદના છે। ચંદુલાલ અહમદાબાદ કે હું।

2. हिंदी के अधिकरण परसर्ग 'में' के स्थान पर गुजराती में 'માં' (मां) का प्रयोग होता है।

उदाहरण:

- 1) નાસ્તામાં શું છે ? નાશતે મें ક्या है?
નાસ્તામાં શું છે?
- 2) ગામમાં નાનો બગીચો છે. ગाँવ में છोटा બगીचा है।
ગામમાં નાનો બગીચો છે।